https://archive.org/details/bk743/page/n0/mode/1up

1979-01-19 -Dhansura Samaj -Samadhan with Satpanthis (743)

All Items on https://archive.org/details/realpatidar

realpatidar.com

Full Library on https://realpatidar.com/library

॥ શ્રી ઉમિયા માતાકી જય ॥

સાબરકાંઠા વિભાગમાં વસતા શ્રી કચ્છી ક. પાટીદાર જ્ઞાતિનાં બે જૂથો વચ્ચે ચાલતા સંઘર્ષ અંગે

* લવાદ પંચનો ચુકાદો *

ગુજરાતમાં વસતા કચ્છી કડવા પાટીદાર ભાઈઓ વચ્ચે, ધનસુરા મધ્યે શ્રી ક. ક. પાટીદાર સનાતન સમાજના નામે ચાલતી સંસ્થાના સભ્યપદના પ્રશ્ને એક જોરદાર વિવાદ ઊભો થયો જેના પરિણામે અલગ અલગ માન્યતાઓ વાળાં બે જૂથો અમુક વ્યકિતઓની આડમાં એકબીજા સામે સંઘર્ષમાં ઉતરી કોર્ટે ચડયાં એકે આરોપ્યું કે જે સનાતની નથી તેને સંસ્થાના સભ્ય થવાનો કોઇ હકક નથી જયારે બીજાએ કહયું કે અમે સનાતની છીએ અને સભ્ય ફી ભરી છે. તેથી અમે સભ્ય છીએ અને અમને ગેર-બંધારણીય રીતે સભ્ય તરીકે રદ ગણવામાં આવ્યા છે. આ મુદ્દાને લઇને મોડાસા કોર્ટમાં તેમજ અરસપરસ દબાવ ખાતર બીજી કોર્ટોમાં પણ વ્યકિતઓના આશ્રયે પક્ષકાર ખટલાઓ શરૂ કરવામાં આવ્યા.

આ ઘર્ષણના આવા સમાચાર આડકતરી રીતે તેમજ પક્ષકારો દ્વારા જાણવા મળતાં ગુજરાત બહાર વસતા ક. ક પાટીદર જ્ઞાતિજનોને દુ:ખ થયું અને સમાધાન માટેના પ્રયાસો થવા લાગ્યા. સ્થાનિક ક્ષેત્રે પણ ઇતર કોમોમાં આ વિવાદ અંગે કુતુહલ જાગ્યુ અને પ્રતિષ્ઠિત કચ્છી પટીદારો પ્રત્યે વિસ્મયકારક પ્રશ્નો રજૂ થવા લાગ્યા. "માનહાની એ બહુમાનીને મૃત્યુ કરતાં પણ વિશેષ દુઃખકર હોય છે." તે ન્યાયે પક્ષકારોમાં પણ સમાધાન માટેની વૃત્તિ જાગવા માંડી કોર્ટ બહાર નિરાકરણ માટે લવાદપંચની આવશ્યકતા જણાઇ અને બંને પક્ષકારોએ શ્રી ક. ક. પાટીદાર સમાજ-મુંબઇનો સંપર્ક સાધ્યો અલગ અલગ જઇને અને પરિણામે તા. ૧૫-૧-૭૯ ના રોજ મુંબઇથી (૧) શ્રી મણીલાલભાઇ પુંજાભાઇ (૨) શ્રી માવજીભાઇ પેથાભાઇ પોકાર (૩) શ્રી વિશ્રામભાઇ હંસરાજભાઇ (૪) શ્રી પ્રેમજીભાઇ શિવગણભાઇ (૫) શ્રી શિવદાસભાઇ લાલજીભાઇ તથા (૬) શ્રી લખમશીભાઇ લધાભાઈ તેમજ અમદાવાદ થી શ્રી જેઠાભાઇ પુંજાભાઇ તથા વડોદરાથી શ્રી રતનશીભાઇ નારાયણભાઇ તથા

માર્ચ-૭૯

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com
Page 1 of 10

https://archive.org/details/bk743/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

Real Patidar
Unravel Truth

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 1, 2, 3, 4, 5.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v5.py

https://archive.org/details/bk743/page/n2/mode/1up

1979-01-19 -Dhansura Samaj -Samadhan with Satpanthis (743)

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.02.19 15:18:13 +05'30'

Real Patidar
Unravel Truth

realpatidar.com

॥ શ્રી ઉમિયા માતાકી જય ॥

સાબરકાંઠા વિભાગમાં વસતા શ્રી કચ્છી ક. પાટીદાર જ્ઞાતિનાં બે જૂથો વચ્ચે ચાલતા સંઘર્ષ અંગે

* લવાદ પંચનો ચુકાદો *

ગુજરાતમાં વસતા કચ્છી કડવા પાટીદાર ભાઈઓ વચ્ચે, ધનસુરા મધ્યે શ્રી ક. ક. પાટીદાર સનાતન સમાજના નામે ચાલતી સંસ્થાના સભ્યપદના પ્રશ્ને એક જોરદાર વિવાદ ઊભો થયો જેના પરિણામે અલગ અલગ માન્યતાઓ વાળાં બે જૂથો અમુક વ્યકિતઓની આડમાં એકબીજા સામે સંઘર્ષમાં ઉતરી કોર્ટે ચડયાં એકે આરોપ્યું કે જે સનાતની નથી તેને સંસ્થાના સભ્ય થવાનો કોઇ હકક નથી! જયારે બીજાએ કહ્યું કે અમે સનાતની છીએ અને સભ્ય ફી ભરી છે. તેથી અમે સભ્ય છીએ અને અમને ગેર-બંધારણીય રીતે સભ્ય તરીકે રદ ગણવામાં આવ્યા છે. આ મુદ્દાને લઇને મોડાસા કોર્ટમાં તેમજ અરસપરસ દબાણ ખાતર બીજી કોર્ટોમાં પણ વ્યકિતઓના આશ્રયે પક્ષકાર ખટલાઓ શરૂ કરવામાં આવ્યા.

આ ઘર્ષણના આવા સમાચાર આડકતરી રીતે તેમજ પક્ષકારો દ્વારા જાણવા મળતાં ગુજરાત બહાર વસતા ક. ક પાટીદર જ્ઞાતિજનોને દુ:ખ થયું અને સમાધાન માટેના પ્રયાસો થવા લાગ્યા. સ્થાનિક ક્ષેત્રે પણ ઇતર કોમોમાં આ વિવાદ અંગે કુતુહલ જાગ્યુ અને પ્રતિષ્ઠિત કચ્છી પટીદારો પ્રત્યે વિસ્મયકારક પ્રશ્નો રજૂ થવા લાગ્યા. "માનહાની એ બહુમાનીને મૃત્યુ કરતાં પણ વિશેષ દુઃખકર હોય છે." તે ન્યાયે પક્ષકારોમાં પણ સમાધન માટેની વૃત્તિ જાગવા માંડી કોર્ટ બહાર નિરાકરણ માટે લવાદપંચની આવશ્યકતા જણાઇ અને બંને પક્ષકારોએ શ્રી ક. ક. પાટીદાર સમાજ-મુંબઇનો સંપર્ક સાધ્યો અલગ અલગ જઇને અને પરિણામે તા. ૧૫-૧-૭૯ ના રોજ મુંબઇથી (૧) શ્રી મણીલાલભાઇ પુંજાભાઇ (૨) શ્રી માવજીભાઇ પેથાભાઇ પોકાર (૩) શ્રી વિશ્રામભાઇ હંસરાજભાઇ (૪) શ્રી પ્રેમજીભાઇ શિવગણભાઇ (૫) શ્રી શિવદાસભાઇ લાલજીભાઇ તથા (૬) શ્રી લખમશીભાઇ લધાભાઈ તેમજ અમદાવાદથી શ્રી જેઠાભાઇ પુંજાભાઇ તથા વડોદરાથી શ્રી રતનશીભાઇ નારાયણભાઇ તથા

માર્ચ-૭૯

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com
Page 1 of 10

https://archive.org/details/bk743/page/n3/mode/1up

જબલપુરથી શ્રી રામજીભાઇ શામજીભાઇ એમ. નવ જ્ઞાતિ ભાઇઓનું એક મંડળ સમાધાનના આશયથી આવ્યું અને બંને પક્ષોનો સંપર્ક સાધવાથી તા. ૧૨-૧-૧૯૭૯ ના રોજ બંને એ તે મંડળની મૌખિક લવાદપંચ તરીકેની નીમણુંક કરી અને પોતપોતાના પક્ષોમાંથી જવાબદાર અગ્રગણ્ય ભાઇઓની એક એક સમિતિ પંચના સતત સંપર્કમાં રહેવા નક્કી કરી તદુપરાંત બંને પક્ષોએ પોતપોતાની માગણીઓની વિશદ ચર્ચા કર્યા બાદ, લેખિત રજૂઆત કરી ત્યારબાદ લવાદપંચની સૂચનાનુસાર બંને પક્ષોએ સ્ટેમ્પ પેપર ઉપર લખાણ આપી લવાદોનો રીતસરનો અધિકાર આપ્યો અને સોમવાર તા. ૧૫-૧-૭૯ ના રોજ કોર્ટમાં ચાલુ રહેલા અરસપરસના બધાજ ખટલા તથા ચેરીટી કમિશ્નર સમક્ષની અરજી વગેરે પાછા ખેંચી લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી અને લવાદપંચે કામગીરી ચાલુ કરી.

પંચની સમક્ષ નીચે જણાવેલ મુદ્દાઓ તપાસ અને નિર્ણય માટે રજૂ થયા હતા.

(૧) શ્રી નાનજીભાઇ કાનજીભાઇ સાથેનો હીસાબ અને લેણાની વસુલી અને ખટલાઓ પાછા ખેંચવા બાબત.

(૨) સમાજનું સભ્યપદ, માન્યતા અને અમાન્યતા તથા બંધારણમાં ફેરફાર કરવા બાબત.

(૩) કારોબારી અને પ્રતિનિધિત્વ.

(૪) ભવિષ્ય માટેનો વ્યવહાર સરળ થવા બાબત.

ઉપર્યુકત મુદ્દાઓની તપાસ લવાદપંચે શરૂ કરી અને જે નિર્ણયો કરવામાં આવ્યા તે નીચે મુજબ છે.

સમાજ અને શ્રી નાનજીભાઇ કાનજીભાઇ તથા બીજા ભાઇઓ વચ્ચે કોર્ટોમાં ચાલતા તમામ કેસો લવાદપંચની સુચના અનુસાર બંને પક્ષો તરફથી પાછા ખેંચી લેવામાં આવ્યા છે અને ચેરીટી કમિશ્નર સમક્ષ કરવામાં આવેલી અરજી પણ પાછી ખેંચી લેવામાં આવી છે એટલે બધાજ ખટલાઓનો અંત લાવવામાં આવ્યો અને બંને પક્ષો તરફથી સમાજના વિવાદોનો નિર્ણય સમાજનાજ ભાઇઓ દ્વારા લાવવાની નીતિ અપનાવી છે તે પ્રશંસનીય છે.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk743/page/n4/mode/1up

realpatidar સમાજ તથા શ્રી નાનજીભાઇ કાનજીભાઇ વચ્ચે હીસાબ અંગેના વિવાદને હાથ ધરતાં બેન પાર્વતીબેનના ભરણપોષણ નિમિત્તેના અમાનત રખાયેલા રૂા. ૧૦,૦૦૦/– તથા લવાદપંચે નક્કી કરેલ વ્યાજના રૂા. ૨,૦૦૦/– મળીને કુલ રૂા. ૧૨,૦૦૦/– અક્ષરે રૂપિયા બાર હજાર પુરા રોકડા બેન પાર્વતીબેનને તેના ભાઇશ્રી કાન્તિલાલ કરસનભાઇની હાજરીમાં નાનજીભાઇ કાનજીભાઇ તરફથી ચૂકવી આપવામાં આવ્યા છે. જેની પહોંચ પણ મેળવવામાં આવી છે.

સમાજની લેતીદેતી બારામાં હીસાબ કરતાં શ્રી નાનજીભાઇ કાનજીભાઇ ખાતે નીકળતા રૂા. ૧૫,૮૦૦/– પંચની સમક્ષ સમાજને ચૂકવી આપવામાં આવ્યા છે જેમની પહોંચ પણ લેવામાં આવી છે. અને રૂા. ૧૨,૫૫૪/– નો હીસાબ શ્રી નાનજીભાઇ કાનજીભાઇ તરફથી સમાજના મંત્રીશ્રી બેચરભાઇ મુળજીભાઇને તા. ૮–૬–૧૯૭૮ના રોજે સમજાવી અને ચુકવી આપ્યો હતો અને તે બાબતની ચોખવટ પણ કરવામાં આવી હતી એટલે સમાજના કોઇ હીસાબની લેતીદેતી શ્રી નાનજીભાઈ કાનજીભાઇ હસ્તે હવે આજ સુધીની બાકી રહેતી નથી.

જાગૃતિ કાર્યાલયના કુલ્લે રૂા. ૩૪૦૦૦/– સમાજના કાર્યકર ભાઇઓ જણ સાત પાસે વ્યાજે મુકવામાં આવેલ છે તે પૈકીના રૂા. ૫૫૦૦/– શ્રી નાનજીભાઈ કાનજીભાઇ પાસે પણ રહે છે. તો તે રકમ જ્યારે કાર્યાલય બધા ભાઇઓ પાસે માગણી કરે ત્યારે શ્રી નાનજીભાઇ કાનજીભાઇએ પણ ચૂકવવાના રહેશે. આથી આ સિવાય સમાજનો જાગૃતિ કાર્યાલય અંગેનો પણ કોઇ હિસાબ શ્રી નાનજીભાઈ કાનજીભાઇ હસ્તક રહેતો નથી.

આમ સમાજ તથા શ્રી નાનજીભાઇ વચ્ચે હીસાબ પંચ સમક્ષ પૂર્ણ થયો છે અને પંચને આ બારામાં સુખદ અંત લાવવામાં સહકાર બંને પક્ષોએ સારો આપ્યો છે.

શ્રી વાલજીભાઇ કાનજીભાઈ તથા શ્રી નાનજીભાઈએ સમાજને લાંબા સમય સુધી ખૂબ સેવા આપી છે પરંતુ હાલના સંજોગોના સંદર્ભમાં શ્રી નાનજીભાઇએ સમાજને સક્રિય સેવા આપવાની લેખિત નાખુશી જણાવી છે આશા છે કે સમાજ તેની શકિતનો લાભ લેશે.

આ તબક્કે એ બાબતની નોંધ લેવી પડે છે કે સમાજના અગ્રણી જેવા શ્રી નાનજીભાઇ સમાજના હિતને હાનિકર્તા પ્રવૃત્તિમાં સહભાગી થયા જે યોગ્ય થયું

realpatidar.com

https://archive.org/details/bk743/page/n5/mode/1up

realpatidar.com

નથી. પરંતુ હવે તે વિવાદનો સુખદ અંત આવ્યો છે અને આશા છે કે તેઓ સમાજ હિતાર્થે પોતાની શક્તિનો સદુપયોગ કરતા રહેશે.

સમાજ તરફથી તા. ૯–૬–૧૯૭૮ના રોજ મળેલી કારોબારી સભાએ જે સભ્યોને અમાન્ય કર્યા છે. તે બાબતમાં પંચે બંને પક્ષો સાથે લંબાણથી ચર્ચા કરી છે અને પંચ નીચે મુજબના નિર્ણય ઉપર સર્વાનુમતે આવ્યો છે.

સમાજના નામ અંગે " શ્રી ક. ક. પા. સનાતન સમાજ, ધનસુરા " આ નામથી સંસ્થા ચાલે છે અને તે બંધારણીય સંસ્થા છે અને જેનુ બંધારણ સન ૧૯૭૨માં રજીસ્ટર કરવામાં આવ્યું છે અને સમાજના નામમાં ફેરફાર કરવાનો કોઇ પ્રશ્ન જ નથી.

સભ્યપદનો પ્રશ્ન ખાસ અગત્યનો હોવાથી બંને પક્ષકારોની પ્રતિનિધિ સમિતિઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી અને ચર્ચામાં હકીકતો રજૂ થઇ કે સભ્યપદ માટેની ફી લઇને સભ્ય બનાવ્યા બાદ બંધારણીય રીતે રદ કરી શકાય નહિ અને અમાન્ય કરાયેલા બધા જ સભ્યો સનાતની નથી એમ કહી શકાય નહીં એટલે સમગ્ર રીતે એક જ સિધ્ધાંત પળાયો નથી. અને જે સભ્યો બનાવાયા છે તે સનાતન સમાજના બંધારણ અનુસાર બનાવવામાં આવ્યા છે, અને અ. ભા. ક. ક. પાટીદાર સમાજના રીતરીવાજો અને ધારાધોરણને માન્ય રાખીને સભ્ય બન્યા છે તો કયા સભ્યો સનાતની નથી તેનો વિવાદ ઊભો ન કરતાં હાલના તબક્કે જે સભ્યો બનાવવામાં આવ્યા છે તેમને માન્યતા આપવી અને તેવા સભ્યોએ સમાજના બંધારણ અને અ. ભા. ક. ક. પાટીદાર સમાજના રીતરિવાજો અને ધારાધોરણ પ્રમાણે વર્તવાનું રહેશે અને તે મુજબ વર્તન કરવાની રજૂઆત કરવામાં આવી છે તો સમાજે જે ભાઇઓ સનાતન સમાજના સભ્ય બનતા હોય અને જ્ઞાતિના રીતરિવાજો અને ધારાધોરણ અનુસાર વર્તવા માગતા હોય તો તેને આવકારવા જોઇએ એટલે હાલના તબક્કે નોંધાયેલા સભ્યોને માન્ય કરવામાં આવે છે અને સર્વ ભાઇઓ સમાજમાં કેળવણી અને સામાજિક એકતા અંગે સાથ સહકાર અને ભાવનાથી કાર્ય કરશે તેવી આશા છે.

સમાજના બંધારણ અનુસાર તા. ૨–૧–૧૯૭૨ના રોજે સમાજની જનરલ સભાએ કારોબારી સમિતિની ચૂંટણી કરી છે અને તે કારોબારીએ સન ૧૯૭૭ સુધી વહીવટ ચલાવ્યો છે. અને ત્યારબાદ ૩–૯–૭૭ ની સામાન્ય સભાએ નવી કારોબારીની ચૂંટણી કરી છે દરમ્યાનમાં એક પણ જનરલ સભા મળી નથી. અને

realpatidar.com

https://archive.org/details/bk743/page/n6/mode/1up

realpatidar.com

મુજ લાંબા સમય બાદ કારોબારી સમિતિની ચૂંટણી કરવામાં આવી છે તો સમાજના કાર્યકર ભાઈઓએ સમાજના બંધારણ અનુસાર કાર્ય કરવામાં ચુસ્ત રહેવું જોઇએ અને બંધારણ અનુસાર કાર્ય કરવું જોઇએ એ કાર્યકર્તાઓની ફરજ છે. તા. ૩–૯–૭૭ના રોજ ચૂંટાયેલ કારોબારી સમિતિની મુદત બંધારણ અનુસાર પૂરી થઈ નથી તો મુદત પૂરી થયે જનરલ સભા બોલાવવી અને કા. સમિતિની ચૂંટણી કરવી. અને તે દરમ્યાન હાલની ચૂંટાયેલી કારોબારી સમિતિએ કાર્ય કરવું ચાલુ ચૂંટાયેલી કારોબારી સમિતિને જો યોગ્ય જણાય અને કારોબારીમાં ફેરફાર કરવા ઇચ્છે તો સક્રિય કાર્યકરોને લઈને કરી શકશે, સમાજના કાર્યકર ભાઈઓએ ધ્યાન રાખવાની ખાસ જરૂર છે કે એક બીજા પ્રત્યે ભાવના ઉત્પન્ન થાય તેવા પ્રયાસો કરવા જોઇએ અને અનુકુળ વાતાવરણ સર્જવું જોઇએ.

ઉપરની બધી જ હકીકતોની નજરે લવાદપંચ એવો નિર્ણય કરે છે કે શ્રી ક. ક. પાટીદાર સનાતન સમાજ ધનસુરા વતી જે સભ્યોને અમાન્ય રખાયા છે તેમને આથી માન્યતા આપવામાં આવે છે અને સભ્યો અખિલ ક. ક. પાટીદાર સમાજે ઘડેલા અને છાપીને પ્રગટ કરેલા રીતરિવાજો અને ધારાધોરણનુ ચુસ્ત પાલન કરશે અને તો જ આ સમાજના સભ્ય તરીકે ચાલુ રહી શકશે.

કારોબારીની ચૂંટણી બંધારણના નિયમ અનુસાર થવી જોઇએ. બંધારણની કલમોમાં પણ ફેરફાર તેની રૂએ જ કરી શકાશે.

ઉપર મુજબનો નિર્ણય અમો લવાદપંચના સભ્યોએ ઈશ્વરની સાક્ષીએ નિષ્પક્ષ પણે અને જ્ઞાતિના હિતને ધ્યાનમાં રાખીને કરેલ છે.

ધનસુરા
તા. ૧૯મી જાન્યુઆરી ૧૯૭૯
વાર શુક્રવાર

લવાદપંચ

(૧) મણીલાલ પુંજાભાઇ પટેલ
(૨) માવજીભાઇ પેથાભાઇ પોકાર
(૩) વિશ્રામ હંસરાજ પટેલ
(૪) પ્રેમજી સવગણ પટેલ
(૫) સવદાસ લાલજી માવાણી
(૬) લખમશી લધ્ધા પટેલ
(૭) જેઠાભાઇ પુંજાભાઇ પટેલ
(૮) રતનશી નારણભાઈ પટેલ
(૯) રામજીભાઇ શામજીભાઈ પટેલ
(જબલપુર)

realpatidar.com

realpatidar.com

॥ શ્રી ઉમિયા માત કી જય ॥

આજે તેર ગામોમાં વસતા શ્રી કચ્છી ક.પાટીદાર
જ્ઞાતિની બે જૂથો વચ્ચેના
આજના સમાધાન પ્રસંગે

સતપંથનો ખુલાસો

ગુજરાતમાં વસતા કચ્છી કડવા પાટીદાર ભાઈઓમાં વચ્ચે, ધનસુરા મુકામે શ્રી ક.ક. પાટીદાર સમાજના નામે ચાલતી સંસ્થાના સભ્યપદના મુદ્દે એક બેરહમ વિવાદ ઊભો થયો તેના પરિણામે સમાજ [illegible] ઘણા [illegible] છે. જુદી જુદી [illegible] ની સમાજમાં એક [illegible] ઊભી કરી [illegible]. એક [illegible] કે [illegible] સનાતની [illegible] તેમ [illegible] થવાનો કોઈ હક્ક નથી જાહેર [illegible] કહ્યું કે અમે સનાતની છીએ અને સભ્ય-ફી ભરી છે તેથી [illegible] અને [illegible] ગેરકાયદેસર રીતે સભ્ય [illegible] છે. આ મુદ્દાને લઈને [illegible] કોર્ટમાં [illegible] કોર્ટમાં પણ [illegible] શરૂ કરવામાં આવ્યા.

આ ઘર્ષણના [illegible] રીતે [illegible] ગુજરાત બહાર વસતા ક.ક. પાટીદાર જ્ઞાતિજનોને દુઃખ થયું અને સમાધાન [illegible] થવા લાગ્યા. [illegible] પણ [illegible] આ વિવાદ [illegible] અને પ્રતિષ્ઠિત કચ્છી પાટીદાર [illegible] થવા લાગ્યા. [illegible] પણ વિશેષ દુઃખકર [illegible] તે [illegible] પણ સમાધાન [illegible] વૃત્તિ [illegible]. [illegible] સતપંથની [illegible] અને [illegible] શ્રી ક.ક. પાટીદાર સમાજ-મુંબઈ [illegible] અને [illegible] (૧) શ્રી [illegible]લાલભાઈ પૂંજાભાઈ (૨) શ્રી [illegible]ભાઈ [illegible]ભાઈ પોકાર (૩) શ્રી [illegible] (૪) શ્રી [illegible] (૫) શ્રી [illegible] તથા (૬) શ્રી [illegible] શ્રી [illegible]ભાઈ પૂંજાભાઈ તથા [illegible] શ્રી [illegible] [illegible]

— ૨ —

realpatidar.com

https://archive.org/details/bk743/page/n8/mode/1up

realpatidar.com

...સમાધાનથી
સ્થાપ્યું અને બંને પક્ષોનો સંપર્ક સાધતાથી તા.૧૨/૧/૧૯૭૯
ના રોજ બંને એ તે મંડળની મૌખિક લવાદ પંચ તરીકે
નીમણૂંક કરી અને પોતપોતાના પક્ષોમાંથી જવાબદાર
આગેવાન ભાઈઓની એક એક સમિતિ પંચના સતત
સંપર્કમાં રહેવા નક્કી કરી. તદુપરાંત બંને પક્ષોએ પોત-
પોતાની માગણીઓની, વિશદ ચર્ચા કર્યા બાદ, લેખિત
રજૂઆત કરી. ત્યારબાદ લવાદ પંચની સૂચનાનુસાર
બંને પક્ષોએ સ્ટેમ્પ પેપર ઉપર બંધનકર્તા લવાદીનો
[illegible] અધિકાર આપ્યો અને સોમવાર તા.૧૫/૧/૧૯૭૯
ના રોજ કોર્ટમાં ચાલુ રહેલા પરસ્પરના બધા જ
ખટલા તથા ચેરીટી કમિશનર સમક્ષની અરજી વગેરે
પાછા ખેંચી લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી.
અને લવાદ પંચે કામગીરી ચાલુ કરી.

પંચની સમક્ષ નીચે જણાવેલ મુદ્દાઓ તપાસ
અને નિર્ણય માટે રજૂ થયા હતા :—

(૧) શ્રી નાનજીભાઈ કાનજી આદિનો હિસાબ અને
લેણાંની વસુલી અને ખટલાઓ પાછા ખેંચવા બાબત.

(૨) સમાજનું સભ્યપદ, માન્યતા અને અમાન્યતા તથા
બંધારણમાં ફેરફાર કરવા બાબત.

(૩) કારોબારી અને પ્રતિનિધિત્વ.

(૪) ભવિષ્ય માટેનો વ્યવહાર સરળ થવા બાબત.

ઉપર્યુક્ત મુદ્દાઓની તપાસ લવાદ પંચે શરૂ કરી અને
જે નિર્ણયો કરવામાં આવ્યા તે નીચે મુજબ છે :—

સમાજ અને શ્રી નાનજીભાઈ કાનજીભાઈ તથા
બીજા ભાઈઓ વચ્ચે કોર્ટમાં ચાલતા તમામ કેસો
લવાદ પંચની સૂચના અનુસાર બંને પક્ષો તરફથી
પાછા ખેંચી લેવામાં આવ્યા છે અને ચેરીટી કમિશનર
સમક્ષ કરવામાં આવેલી અરજી પણ પાછી ખેંચી-
લેવામાં આવી છે. એટલે બધા જ ખટલાઓનો
અંત લાવવામાં આવશે અને બંને પક્ષો તરફથી સમાજના
વિવાદોનો નિર્ણય સમાજના જ ભાઈઓ દ્વારા લાવવાની
નીતિ અપનાવી છે તે પ્રશંસનીય છે.

સમાજ તથા શ્રી નાનજીભાઈ કાનજીભાઈ વચ્ચે
હિસાબ અંગેના વિવાદને શાંત કરતાં. [illegible]
ભરણપોષણ નિમિત્તેના [illegible] રખાયેલા રૂ.૧૦,૦૦૦/-
તથા લવાદ પંચે નક્કી કરેલ વ્યાજના રૂ.૨,૦૦૦/- મળી
કુલ રૂ.૧૨,૦૦૦/- અંકે રૂ. બાર હજાર પૂરા [illegible]

realpatidar.com

realpatidar.com

[illegible] નં. [illegible]

[illegible] ઓર્ગેનાઈઝેશન ની તેના ભાઈ શ્રી [illegible] નીચેના ફકરામાં જે [illegible] શ્રી નાનજીભાઈ કાનજીભાઈ ૧૨ [illegible] [illegible] આવેલ છે. જેની [illegible] પત્ર [illegible] આવી છે.

સમાજની લેણીદેણીની ભાવનામાં [illegible] કરતી [illegible] નાનજીભાઈ કાનજીભાઈ પાસે [illegible] રૂ. ૨૫,૦૦૦/- [illegible] સમાજને [illegible] આપવામાં આવ્યા છે જેની પહોંચ પત્ર લેવામાં આવી છે. [illegible] રૂ. ૧૨,૫૦૦/- ની [illegible] શ્રી નાનજીભાઈ કાનજીભાઈ તરફથી સમાજના મંત્રી શ્રી [illegible]ભાઈ [illegible] ને તા. ૯/૧૨/૧૯૭૮ ના રોજ સમાજની [illegible] આપવામાં આવ્યો હતો અને તે [illegible]. [illegible] પત્ર [illegible] કરવામાં આવી હતી. એટલે સમાજના કોઈ હિસાબની લેણીદેણી શ્રી નાનજીભાઈ કાનજીભાઈ [illegible] હવે [illegible] બાકી રહેતી નથી.

જાગૃતિ કાર્યાલયના કુલ રૂ. ૩૯,૦૦૦/- સમાજના [illegible] ભાઈઓ [illegible] ચૂકવવામાં આવેલ છે તે પૈકીના રૂ. ૫,૫૦૦/- શ્રી નાનજીભાઈ કાનજીભાઈ પાસે [illegible] રહે છે. તો તે રકમ જ્યારે કાર્યાલય [illegible] ભાઈઓ પાસે માગણી કરે ત્યારે શ્રી નાનજીભાઈ કાનજીભાઈએ [illegible] ચૂકવવાના રહેશે. આથી આ સિવાય સમાજનો જાગૃતિ કાર્યાલય અંગેનો [illegible] કોઈ હિસાબ શ્રી નાનજીભાઈ કાનજીભાઈ [illegible] રહેતો નથી.

આમ સમાજ તથા શ્રી નાનજીભાઈ વચ્ચેનો હિસાબ [illegible] પૂર્ણ થયો છે અને [illegible] ભાવનામાં [illegible] [illegible] આવ્યો છે.

શ્રી [illegible] કાનજીભાઈ તથા શ્રી નાનજીભાઈએ સમાજની [illegible] સુધી [illegible] સેવા આપી છે પરંતુ હાલના [illegible] શ્રી નાનજીભાઈએ સમાજને [illegible] સેવા આપવાની [illegible] જણાવી છે. [illegible] છે સમાજ તેની શક્તિનો લાભ લેશે.

આ તબક્કે એક [illegible] નોંધ લેવી પડે છે કે સમાજના [illegible] શ્રી નાનજીભાઈ સમાજના હિતને [illegible] પ્રવૃત્તિમાં [illegible] યોગ્ય [illegible] નથી. પરંતુ હવે તે વિવાદનો સુખદ અંત આવેલો છે અને [illegible] સમાજના હિતાર્થે પોતાની શક્તિનો ઉપયોગ કરતા રહેશે.

સમાજ તરફથી તા. ૯/૧૨/૧૯૭૮ ના રોજ [illegible] [illegible] પૂજ્ય [illegible]

realpatidar.com

realpatidar.com

[illegible] લીધે ગુજરાતના [illegible] ઉપર [illegible] ને
આપેલ છે.
[illegible] માં આવા [illegible] શ્રી ક.ક. પાટીદાર સમાજ
[illegible]
[illegible]
[illegible]
[illegible] નથી.
[illegible] હોવાથી તેમને [illegible]
પ્રતિનિધિ [illegible] કરવામાં [illegible]
[illegible]
[illegible] કરી શકાશે [illegible]
[illegible] કરી શકાશે
[illegible] નથી. અને
[illegible] સમાજના બંધારણ અનુસાર
[illegible] અ.ભા. ક.ક. પાટીદાર સમાજના
નીતિનિયમો [illegible] સત્ય [illegible]
[illegible] ના કરવી
[illegible]
[illegible] સમાજના બંધારણ
અને અ.ભા. ક.ક. પાટીદાર સમાજના નીતિનિયમો અને
બંધારણ પ્રમાણે વર્તવાનું રહેશે. અને તે [illegible]
વર્તન કરવાની [illegible] કરવામાં આવી છે. તો [illegible]
જે ભાઈઓ સનાતન સમાજના સભ્ય બનતા હોય અને
જ્ઞાતિના નીતિનિયમો અને બંધારણ અનુસાર વર્તવા
માગતા હોય તો તેમને આવકારવા જોઈએ. એટલે [illegible]
તાલુકાના [illegible] ને [illegible] કરવામાં આવે છે. [illegible]
[illegible] સમાજમાં [illegible]
[illegible] કાર્ય કરશે એવી આશા છે.
સમાજના બંધારણ અનુસાર તા. ૨૫/૧૨/૭૮ ના
રોજ સમાજની જનરલ સભાએ કારોબારી સમિતિની
ચૂંટણી કરી છે અને તે કારોબારીએ તા. ૧૮-૧-૭૯ [illegible]
[illegible] ૩/૯/૭૭ ની
[illegible] કારોબારીની ચૂંટણી કરી છે
[illegible] જનરલ સભા [illegible]
[illegible] કારોબારી સમિતિની
ચૂંટણી કરવામાં આવી છે તો સમાજના કાર્યકર ભાઈઓએ
સમાજના બંધારણ અનુસાર કાર્ય કરવામાં [illegible]
રહેવું જોઈએ અને બંધારણ અનુસાર કાર્ય [illegible]
એ કાર્યકર્તાઓની ફરજ છે. તા. ૩/૯/૭૭ ના [illegible]
[illegible] સમિતિની ચૂંટણી બંધારણ અનુસાર [illegible] નથી.

realpatidar.com

realpatidar.com

....પૂરી થઈ નથી
તો મુદત પૂરી થયે જનરલ સભા બોલાવવી અને
કા.સમિતિની ચૂંટણી કરવી. અને તે દરમ્યાન હાલની
સૂચવાયેલી કા.સમિતિએ કાર્ય કરવું. આવી ચૂંટાયેલી
કા.સમિતિને જો યોગ્ય જણાય અને કા.માં ફેરફાર
કરવા ઈચ્છે તો સક્રિય કાર્યકરોને લઈને કરી શકશે.

સમાજના કાર્યકર ભાઈઓને ધ્યાન રાખવાની
ખાસ જરૂર છે કે એકબીજા પ્રત્યે ભાવના ઉત્પન્ન થાય
તેવા પ્રયાસો કરવા જોઈએ અને અનુકૂળ વાતાવરણ
રાખવું જોઈએ.

ઉપરની બધી જ બાબતોની બાબતે લવાદપંચ એવો
નિર્ણય કરે છે કે ફરી કલહ કડવા પાટીદાર સમાજમાં
[illegible] વાતો જે [illegible]
[illegible]
સામેલ કરવા કડવા પાટીદાર સમાજે દાખલા અને બધાને
પ્રચાર કરવા નવા વિચારોની અને ધારાધોરણોનું ચુસ્તપાલન
કરશે, અને તો જ આ સમાજના સત્ય વસ્તુ ટકી શકશે.

કાર્યવાહીની ચૂંટણી બંધારણના નિયમ અનુસાર થવી
જોઈએ. બંધારણની કલમોમાં પણ ફેરફાર તેની રૂએ જ કરી
શકાશે.

ઉપર મુજબનો નિર્ણય અમો-લવાદપંચના સભ્યોએ
ઈશ્વરની સાક્ષીએ, નિષ્પક્ષપણે અને જ્ઞાતિના હિતને ધ્યાનમાં
રાખીને કરેલ છે :—

લવાદપંચ

ધનસુરા:
તા. ૧૯મી જાન્યુઆરી ૧૯૭૯.

(૧) [illegible signature]
(૨) [illegible] પટેલ
(૩) [illegible signature]
(૪) [illegible signature]
(૫) [illegible signature]
(૬) [illegible signature]
(૭) [illegible signature]
(૮) [illegible signature]
(૯) [illegible signature]

realpatidar.com